

M.A. (ECONOMICS) Semester - 1 (CBCS) Examination
Oct/Nov. -2018

THEORIES OF ECONOMIC GROWTH (ELECTIVE-2)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ આર્થિક વૃદ્ધિ મોડેલ એટલે શું? તેનું સ્વરૂપ સમજાવો.
- પ્રશ્ન-૨ પ્રો.એડમ સ્મિથનો આર્થિક વૃદ્ધિનો સિદ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ આર્થિક વૃદ્ધિમાં સંશોધન અને શિક્ષણનો ફાળો વર્ણવો.
- પ્રશ્ન-૩ આર્થિક વૃદ્ધિ અંગેનું હેરોડ-ડોમર મોડેલ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ આર્થિક વૃદ્ધિનાં મોડેલની મર્યાદાઓ જણાવો.
- પ્રશ્ન-૪ આધુનિક આર્થિક વૃદ્ધિની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ આર્થિક વૃદ્ધિ અંગે કાલ્ડોરનો સિદ્ધાંત સમજાવો.
- પ્રશ્ન-૫ નીચે આપેલા ચાર પૈકી કોઈપણ બે નાં જવાબ આપો. (૧૪)
- (૧) આર્થિક વૃદ્ધિનું મહત્વ.
(૨) આર્થિક વૃદ્ધિમાં સંસ્થાઓની ભૂમિકા.
(૩) આર્થિક વૃદ્ધિમાં ટેકનોલોજીનો ફાળો.
(૪) આર્થિક વૃદ્ધિનો માલ્થસનો સિદ્ધાંત.

ENGLISH VERSION

- Que-1 What is economic growth? State the difference between Economic growth and development. (14)
OR
- Que-1 What is meant by economic growth model? Explain its nature.
- Que-2 Explain theory of economic growth given by Adam Smith. (14)
OR
- Que-2 Describe the role of Research and education in economic growth.
- Que-3 Explain the Harrod-Domer model of growth. (14)
OR
- Que-3 Explain the limitation of Economic growth model.
- Que-4 Discuss characteristics of modern Economic growth. (14)
OR
- Que-4 Explain theory of economic growth given by Kaldor.
- Que-5 Write any two answers following four questions. (14)
- (1) Importance of economic growth.
(2) Role of institution in economic growth.
(3) Role of Technology in economic growth.
(4) Theory of economic growth given by Malthus.
